

પ્રેસ નોટ  
ટોરેન્ટ ટેરીફ ઓર્ડર

- અમદાવાદ, ગાંધીનગર અને સુરત વિસ્તારનાં ગ્રાહકો માટે કોઈ કાયમી ટેરિફ વધારો નહીં.
- નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન અગાઉના સમયગાળાની ઘટ વસૂલ થાય ત્યાં સુધી “રેગ્યુલેટરી ચાર્જ” ૪૫ પૈસા/યુનિટ રહેશે. એકવાર પાછલા સમયગાળાની ઘટ વસૂલ થઈ જાય, ત્યારબાદ “રેગ્યુલેટરી ચાર્જ” ની વસૂલાત બંધ કરવામાં આવશે.
- હાલના એફપીપીપીએ ચાર્જ રૂ.૧.૯૮/યુનિટની સામે એફપીપીપીએ ચાર્જ મહત્તમ રૂ.૧.૩૫/યુનિટ રહેશે.
- આથી એકંદરે, અમદાવાદ, ગાંધીનગર અને સુરત વિસ્તારનાં ગ્રાહકો માટે ૧૮ પૈસા/યુનિટનો ઘટાડો થશે.

ટોરેન્ટ પાવર લી. દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫ના ટુ-અપ અને વર્ષ ૨૦૧૬-૧૭ માટે પોતાના વિજ વિતરણ દરો નક્કી કરવા માટેની દરખાસ્ત, જીઈઆરસીના બહુવર્ષીય વિજ દર નક્કી કરવાના વિનિયમો હેઠળ આયોગ સમક્ષ રજૂ કરેલ હતી.

આયોગ દ્વારા સદર દરખાસ્તોની ચકાસણી કર્યા બાદ આમ જનતા અને હિત ધરાવનારાઓ પાસેથી વાંધા અને સૂચનો મંગાવવાની વિસ્તૃત પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. આ અંગે આયોગ દ્વારા તા.૧૫-૦૨-૨૦૧૬ના રોજ ગાંધીનગર ખાતે રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવેલ. આ સુનાવણીમાં હિત ધરાવનારાઓએ, વ્યક્તિગત અને સંસ્થાકીય ધોરણે પોતાના વાંધા/સૂચનો આયોગ સમક્ષ રજૂ કરેલ.

આયોગ (સભ્યશ્રી કે.એમ.શ્રિંગારપૂરે અને સભ્યશ્રી પી.જે.ઠક્કર) દ્વારા તા.૩૧-૦૩-૨૦૧૬ ના રોજ સદર દરખાસ્તો અંગે હુકમો કરવામાં આવેલ છે.

આયોગ દ્વારા બહુવર્ષીય ટેરીફ ઓર્ડરમાં સુરત વિસ્તાર માટે ૫.૧૫% અને અમદાવાદ-ગાંધીનગર વિસ્તાર માટે ૮.૫૦% ડીસ્ટ્રીબ્યુશન લોસ મર્યાદિત કરેલ. જ્યારે હકીકતે વર્ષ ૨૦૧૪-૧૫ માં ટોરેન્ટ પાવર લીમીટેડે ડીસ્ટ્રીબ્યુશન લોસ સુરતમાં ૪.૦૯% અને અમદાવાદ-ગાંધીનગરમાં ૭.૩૪% ની મર્યાદામાં રાખવામાં સફળતા મેળવેલ છે. જે પ્રશંસનીય છે.

ટોરેન્ટ પાવર લી. દ્વારા અંદાજવામાં આવેલ વર્ષ ૨૦૧૪-૧૫ ની રૂ.૭૦૮.૮૦ કરોડની ઘટ સામે આયોગે રૂ.૬૬૪.૫૮ કરોડની ઘટ મંજૂર કરેલ છે. વર્ષ ૨૦૧૬-૧૭ માટે મંજૂર કરાયેલી

વાર્ષિક મહેસૂલી જરૂરીયાત અને આવકના અંદાજ પરથી નક્કી થયેલ સરપ્લસને એડજસ્ટ કર્યા બાદ ટીપીએલ દ્વારા રૂ.૬૩૮.૫૧ કરોડની ઘટ અંદાજવામાં આવેલ છે. જેની સામે આયોગે વર્ષ ૨૦૧૬-૧૭ ની સંયુક્ત ઘટ રૂ.૫૬૦.૫૦ કરોડ અંદાજેલ છે.

ટોરેન્ટ પાવર લી. દ્વારા પાછલા સમયગાળાની ઘટ રૂ.૬૩૮.૫૧ કરોડને “રેગ્યુલેટરી ચાર્જ” ૬૦ પૈસા/યુનિટ લેખે વસૂલ કરવા મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી હતી. જો કે, આયોગ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ની સરપ્લસને એડજસ્ટ કર્યા બાદ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટે પાછલા સમયગાળાની ઘટ રૂ.૪૭૦.૫૦ કરોડને “રેગ્યુલેટરી ચાર્જ” ૪૫ પૈસા/યુનિટ લેખે વસૂલ કરવા દેવાનું માન્ય રાખવામાં આવેલ છે. આયોગ દ્વારા પાછલા સમયગાળાની ઘટને માનનીય એપેલેટ ટ્રીબ્યુનલનાં ચુકાદાને લીધે મંજૂર રાખવામાં આવેલ છે. ફ્યુઅલના ભાવમાં થઈ રહેલા ઘટાડા, ખાસ કરીને ગેસના ભાવમાં થઈ રહેલ ઘટાડાને નજર સમક્ષ રાખી આયોગ દ્વારા એફપીપીપીએ ચાર્જ રીકવરીની મહત્તમ મર્યાદા હાલના રૂ.૧.૯૮/યુનિટ એફપીપીપીએની સામે રૂ.૧.૩૫/યુનિટ રાખવામાં આવેલ છે. આમ, “રેગ્યુલેટરી ચાર્જ” ની રીકવરીની મંજૂરી છતાં એકંદરે દરેક ગ્રાહકના ટેરીફમાં ૧૮ પૈસા/યુનિટનો ઘટાડો થાય તેવું આયોગે ધ્યાન રાખેલ છે. “રેગ્યુલેટરી ચાર્જ” ગ્રાહકોના વિજ બીલોમાં અલગ લાઇનમાં બતાવવામાં આવશે. વર્ષ દરમ્યાન પાછલા સમયગાળાની ઘટ સંપૂર્ણપણે વસૂલ થયે “રેગ્યુલેટરી ચાર્જ” બંધ કરી દેવામાં આવશે. “રેગ્યુલેટરી ચાર્જ” ની વસુલાત અંગેની માહિતી ટોરેન્ટ પાવર પોતાની વેબસાઇટ પર ગ્રાહકોની જાણ સારૂ મૂકશે. પાછલા સમયગાળાની ઘટને વસૂલવા ટેરીફમાં વધારો કરવાને બદલે “રેગ્યુલેટરી ચાર્જ” ની વસુલાત મંજૂર કરેલ છે. જેથી ગ્રાહકો પર કાયમી ધોરણે ભારણ આવે નહીં. વધુમાં રાત્રિના સમય દરમ્યાન વીજળી વપરાશને પ્રોત્સાહન આપવા માટે વિવિધ નિયંત્રણો હતા તેને હળવા કરવામાં આવેલ છે.

આ હુકમ તા.૦૧/૦૪/૨૦૧૬ થી અમલી બનશે. સુધારેલા વિજદરો તા.૦૧/૦૪/૨૦૧૬ થી થતા વીજળી વપરાશ પર લાગુ પડશે.

-સહિ-

રૂપવંતસિંહ(આઇ.એ.એસ.)

સચિવ

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ,  
ગાંધીનગર